

RMC Junior Clerk Question Paper 2021

1. નીચેનામાંથી કયો ગ્રંથ પાણિનિએ રચેલ છે ?
 (A) રાજતરંગિણી
 (C) અષાધ્યાધી
 (B) અંગુતરનિકાય
 (D) ઝતુસંહાર

2. હડપ્પન સમ્ભ્યતાના કયા સ્થળે “વરસાઈ પાણી પ્રબંધન”ની પદ્ધતિ મળી આવી છે ?
 (A) ધોળાવીરા
 (C) કાલીબંગન
 (B) લોથલ
 (D) હડપ્પા

3. જ્યોતિષ શાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ ‘ભૃગુસહિતા’ના રચયિતા કોણા હતા ?
 (A) ખ્રિસ્તગુપ્ત
 (C) વાગ્ભવ
 (B) પારાશર
 (D) વરાહમિહિર

4. ચિતોડમાં આવેલ ‘વિજયસ્તંભ’ (કીર્તિસ્તંભ) કોણે બંધાવેલ છે ?
 (A) રાણા સંગ્રામસિંહ
 (C) રાણા પ્રતાપ
 (B) રાણા હમિર
 (D) રાણા કુંભા

5. અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ?
 (A) મહમૂદ બેગડો
 (C) મુઝફફરશાહ
 (B) અહમદશાહ
 (D) કુતુખશાહ

6. જલિયાંવાલા બાગના હત્યાકંડ પછી બ્રિટીશ સરકારે કઈ તપાસ કમિશનની નિમણૂંક કરી હતી ?
 (A) હંટર કમિશન
 (C) મલબાર કમિશન
 (B) સાયમન કમિશન
 (D) મોન્ટેન્યુ - ચેમ્સફર્ડ કમિશન

7. ભારતના બંધારણમાં રાજ્યોની યાઈમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
 (A) 66
 (C) 97
 (B) 47
 (D) 77

8. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના
 ઓછામાં ઓછાં કેટલા રાજ્યોની સંમતિથી કરી શકાય ?
 (A) $\frac{1}{2}$
 (C) $\frac{1}{4}$
 (B) $\frac{1}{3}$
 (D) $\frac{2}{3}$

9. રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવાં અને ચાલુ રાખવા કુલ કેટલા સભ્યો ઓછામાં ઓછા હાજર રહેવા જરૂરી છે ?

(A) 83 (B) 125
 (C) 166 (D) 25

10. ગંગા નદીનો પ્રવાહ બાંગલાદેશમાં ખ્રિસ્તપુત્રા નદીના પ્રવાહ સાથે મળે છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે ?

(A) ગંડક (B) મેધના
 (C) ભાગીરથી (D) ત્સાંગપો

11. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે ?

(A) ઘોરાડ (B) સુરખાબ
 (C) ચિલોત્રો (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

12. 'સંદેશ' ક્યા વિસ્તારના લોકોની પ્રિય મિઠાઈ છે ?

(A) મદ્રાસ (B) બંગાળ
 (C) રાજ્યસ્થાન (D) કાશ્યાટક

13. 'હેણોતરો' નામનું પ્રાણી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?

(A) ગણસરોવર (અમદાવાદ) (B) જૂનાગઢ
 (C) કંચ્ચ (D) રતનમહાલ

14. નીચેનામાંથી કયું નૃત્ય ડાંગી આદિવાસીઓનું પ્રમુખ નૃત્ય છે ?

(A) કહાડિયા (B) જતરા
 (C) કરમા (D) તાંડવ

15. ભારતે ક્યા દેશની પ્રથાને અનુસરીને GST લાગુ કરેલ છે ?

(A) ફાન્સ (B) કેનેડા
 (C) બ્રિટન (D) જર્મની

16. નીચેનામાંથી કઈ કૃતિ પનાલાલ પટેલ રચિત નથી ?

(A) મળેલા જીવ (B) માનવીની ભવાઈ
 (C) માણસાઈના દીવા (D) ભાગ્યાનાં ભેરૂ

17. નીચેનામાંથી ક્રયું જોડકું સાચું નથી ?
 (A) લિયોનાર્ડો-દ-વિન્ઝી - ધ લાસ્ટ સપર
 (C) રફાયેલ - કિયેશન ઓફ આદમ
 (B) માર્કલ એન્જેલો - ધ લાસ્ટ જ્જમેન્ટ
 (D) પાબ્લો પિકાસો - ગર્લ બિફોર એ મિરર
18. લોહીનું દબાણ માપવા માટેનું સાધન ક્યા નામે ઓળખાય છે ?
 (A) સિંગ્મોભેનોમીટર
 (B) રીફેક્ટોમીટર
 (C) ઓડોમીટર
 (D) બેરોમીટર
19. 300 ફુટની ઊંચાઈએથી નીચે પડતો 'કાકા-કાકી' નો ધોખ ક્યા જીલ્લામાં આવેલો છે ?
 (A) નર્મદા
 (B) તાપી
 (C) છોટાઉંદેપુર
 (D) ડાંગ
20. ટોકિયો ઓલામ્પિક અને પેરાઓલામ્પિક ગેમમાં ગુજરાતની કુલ કેટલી મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો ?
 (A) ત્રણ
 (B) પાંચ
 (C) છ
 (D) આઠ
21. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાંથી ગુજરાતના ક્યા શહેરની પસંદગી કરવામાં આવી છે ?
 (A) સુરત
 (B) માંડવી
 (C) ગાંધીધામ
 (D) રાજકોટ
22. "સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ" નો શુભારંભ ગૃહમંત્રીશ્રીએ ક્યાં કરાવ્યો હતો ?
 (A) મુંબઈ
 (B) બેંગલોર
 (C) દિલ્હી
 (D) ગાંધીનગર
23. સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે 'અટલ-સેવા-શાટલ' આરોગ્યરથનો શુભારંભ ક્યા શહેરથી કરવામાં આવ્યો હતો ?
 (A) ધરમપુર
 (B) દાહોદ
 (C) માંડવી
 (D) મહુવા
24. ભારતીય સેનામાં સામેલ 'K-9 વજ ટેક'નું નિર્માણ ક્યા શહેરમાં થાય છે ?
 (A) રાજકોટ
 (B) સુરત
 (C) ભાવનગર
 (D) અંકલેશ્વર

25. દેશી રજવાડાનું ગૌરવગાન કરતાં ખુલ્લિયમનું નિર્માણ કૃયા શહેરમાં કરવામાં આવશે ?

(A) રાજકોટ

(B) જામનગર

(C) વડ્ધિયા

(D) મોરબી

26. Our sir, teaches mathematics _____ english. ખાલી જગ્યા પૂરો.

(A) across

(B) besides

(C) beside

(D) both

27. Please come _____ the bathroom. ખાલી જગ્યા પૂરો.

(A) over

(B) on

(C) out of

(D) with

28. Might is the "past form" of _____ ખાલી જગ્યા પૂરો.

(A) may

(B) will

(C) can

(D) shall

29. _____ I were the richest person. ખાલી જગ્યો પૂરો

(A) Where

(B) When

(C) Unless

(D) If

30. Pick up correct synonyms of the word : AFFLUENT

(A) Prosperous

(B) Poor

(C) Talkative

(D) Close

31. Select proper antonyms for : BLISS,

(A) Sorrow

(B) Euphoria

(C) Anguish

(D) Mirth

32. 1. Cannons are used in war

2. The Geeta deals with high cannons of morality and religion

Evaluate the sentence

(A) Only 1 is correct

(B) Only 2 is correct

(C) Both 1 and 2 are correct

(D) Both 1 and 2 are not correct

42. નીચેના પૈકી કઈ સંધિ યોગ્ય નથી ?

(A) રવિ + ઈન્ડ = રવીન્ડ

(B) પરમ + ઈશ્વર = પરમેશ્વર

(C) મહા + ઐશ્વર્ય = મહેશાર્ય

(D) વિ + ઉત્પન્ન = વૃત્પન્ન

43. શબ્દો અને તેની ભાષાને યોગ્ય રીતે ગોડવો.

1. ફારસી

a. નિમણુંક

2. અરબી

b. નુકસાન

3. તુક્કી

c. કારકુન

4. મરાಠી

d. જગ્મ

(A) 1 - a, 2 - c, 3 - b, 4 - d

(B) 1 - c, 2 - b, 3 - d, 4 - a

(C) 1 - b, 2 - d, 3 - a, 4 - c

(D) 1 - d, 2 - a, 3 - c, 4 - b

44. નીચેના પૈકી કયા સમાનાર્થી શબ્દની જોડ યોગ્ય છે ?

1. અભિલ - પૂરું

2. અચલ - અવિકારી

3. અમૃત - પીયુષ

4. અનુપમ - ધિક્કાર

(A) 1, 3 અને 4

(B) 1, 2 અને 4

(C) 1, 2 અને 3

(D) 1, 2, 3 અને 4

45. નીચેના પૈકી કયા શબ્દના, અન્ય અનેકાર્થી શબ્દો યોગ્ય નથી ?

(A) અક્ષર - ખ્રમ્લ

(B) અટક - પ્રતિજ્ઞા

(C) અનંત - પાણી

(D) આંક - ઘડિયા

46. નીચેના પૈકી વિરુદ્ધાર્થી શબ્દોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

(A) અમીર - મુફલિસ

(B) અંશ - છેદ

(C) અંત - અનંત

(D) પૂર્વગ - અનુગ

47. ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય ધરાવતા પરંતુ ભિન્ન અર્થભેદ વાળા શબ્દોની જોડીઓ ચકાસો.

1. અફર - નિશ્ચિત # અફળ - નિષ્ફળ

2. અનુસાર - પ્રમારો # અનુસ્વાર - લિપિ ચિહ્ન

(A) માત્ર 1 યોગ્ય છે.

(B) માત્ર 2 યોગ્ય છે.

(C) 1 અને 2 બંને યોગ્ય નથી.

(D) 1 અને 2 બંને યોગ્ય છે.

54. લેખક અને તેઓના ઉપનામ અંગેની કઈ જોડી યોગ્ય નથી ?
 (A) મણિશંકર રત્નાલ ભટ્ટ - કાન્ત (B) બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
 (C) ઉમાશંકર જેઠાલાલ જોધી - વાસુકિ (D) ચિનુભાઈ ચંદુલાલ મોઢી - સ્વૈર વિહારી
55. લેખક અને તેની કૃતિઓની જોડ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
 (A) શ્રી ક.મા. મુનશી - વેરની વસુલાત (B) શ્રી અમૃતલાલ વેગડ - બાપુ સુરજના દોસ્ત
 (C) શ્રી લાભશંકર ઠાકર - એક ઊંદર અને જદુનાથ (D) શ્રી પુરુષરાજ જોધી - જીવનનો આનંદ
56. CD / DVD ઉપર પ્રોગ્રામ રાઈટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ?
 (A) એન્ટી વાયરસ (Anti virus) (B) O.S.
 (C) Nero (D) એક્સેલ (Excel)
57. હાર્ડ ડિસ્કમાં રહેલ અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોડવવા માટે નીચેના પૈકી કયા “ટૂલ”નો ઉપયોગ કરવામાં આવે છે ?
 (A) ડીકેગમેન્ટેશન (B) રીસ્ટોર
 (C) સ્ટોર્ટ્જ (D) બેક અપ
58. દુનિયાની કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાત કરી શકે છે. તે પ્રક્રિયાને શું કહે છે ?
 (A) ઈ-મેઇલ (B) કોન્ફરન્સિંગ
 (C) સીસ્ટમ (D) કલીપીંગ
59. ઈ-મેઇલ, એક કરતા વધારે વ્યક્તિઓને એકી સાથે મોકલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
 (A) Another (B) Attach
 (C) BCC (D) Repeat
60. ઈ-મેઇલ આઈ.ડી. બે ભાગમાં વહેચાયેલા હોય છે, તે ભાગને જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે ?
 (A) # (B) \$
 (C) % (D) @
61. ક્રોમયુટરની પરિભાષામાં નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે ?
 (A) પ્રમોશન (B) પ્રોટોકોલ
 (C) પ્રોપોરેન્ડા (D) પાયરસી

62. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ના કર્મચારીઓ માટે કોમ્પ્યુટર સબંધીત કઈ પરીક્ષા ફરજથાત કરેલ છે ?
 (A) CCC
 ✓ (B) CCC+
 (C) CCC++
 (D) CCC-
63. પાવર પોઇન્ટ એપ્લીકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે ?
 (A) Slide
 (B) Sheet
 (C) Book
 (D) Page
64. નીચેના પૈકી કઈ સીસ્ટમ “ઓપરેટીંગ સીસ્ટમ” છે ?
 (A) Window-95
 (B) Window-ME
 (C) Unix
 ✓ (D) ઉપરોક્ત તમામ
65. Desktop ઉપર આપેલ My Computer ને શરૂ કરવા / open કરવા My Computer આયકોન ઉપર કેટલી વખત “કલીક” કરવામાં આવે છે ?
 (A) 1 વખત
 ✓ (B) 2 વખત
 (C) 3 વખત
 (D) 4 વખત
66. 1. મેનેટીક ટેપ એ સામાન્ય કેસેટ જેવી દેખાય છે પરંતુ તેની સ્ટોરેજ કેપેસીટી ઘણી વધારે છે.
 2. CDનું હુલ ફોર્મ Compact Disk સીડીમાં અલગ અલગ ફોલ્ડરમાં માહીતી એકત્રીત કરી શકાય છે.
 (A) 1 વાક્ય યોગ્ય છે.
 ✓ (B) 2 વાક્ય યોગ્ય છે.
 (C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
 (D) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
67. 1. રીસાયકલ બીનમાં ડિલીટ કરેલ ફોલ્ડર, ફાઈલ રહે છે.
 2. આ ફાઈલો રીસાયકલ બીન ખાલી કરવામાં ન આવે (Empty Recycle Bin) ત્યાં સુધી ત્યાં રહે છે.
 3. રીસાયકલ બીનમાં પડેલ ફાઈલો પરત મેળવી શકાય છે.
 (A) 1 અને 2 યોગ્ય છે.
 ✓ (B) 1 અને 3 યોગ્ય છે.
 (C) 1, 2 અને 3 યોગ્ય છે.
 (D) 2 અને 3 યોગ્ય છે.
68. 1. પેઇન્ટ (paint)માં બનાવેલ ફાઈલને સેવ કરવા “Ctrl + S” નો ઉપયોગ થાય છે.
 2. પેઇન્ટ (paint)ની દરેક ફાઈલનું એક્સટેન્શન .bmp હોય છે.
 (A) 1 અને 2 વાક્યો યોગ્ય છે.
 ✓ (B) માત્ર 1 વાક્ય યોગ્ય છે.
 (C) માત્ર 2 વાક્ય યોગ્ય છે.
 (D) 1 અને 2 વાક્યો યોગ્ય નથી.

78. નીચેના પૈકી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એસેમ્બ્લી લેંગ્વેજ (Assembly language) કઈ છે ?

(A) COBOL

(B) Basic

(C) ARM

(D) Python

79. કોમ્પ્યુટર ડિસ્કની મહત્તમ સંગ્રહ શક્તિ અંદાજે કેટલી હોય છે ?

(A) 550 MB

(B) 750 MB

(C) 1000 MB

(D) 1500 MB

80. લોજિક ચીપ (Logic chip) ને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

(A) PROM

(B) Memory

(C) Micro processor

(D) ROM

81. એક સોસાયટીમાં 8 બંગલાઓને 1 થી 8 ક્રમાંકો આપવામાં આવ્યા છે. આ બંગલાઓ પૈકી ક્યા બંગલા ક્રમાંકના આગળના બંગલાઓના બધાજ ક્રમાંકોનો સરવાળો તે જ બંગલાની પછીના બધાજ ક્રમાંકના સરવાળા જેટલો છે ?

(A) 7

(B) 4

(C) 5

(D) 6

82. સમાંતર શ્રેષ્ઠી 100, 97, 94, 91 નું ક્યું પદ તેનું પહેલું ઝણ પદ હોય ?

(A) 75

(B) 35

(C) 45

(D) 55

83. મહેશે એલ.સી.ડી. ટીવી રૂ. 32,500/- માં ખરીદ્યું. ખરીદતી વખતે પ્રારંભિક ચૂકવણી રૂપે તેણે રૂ. 200/- રોકડા વેપારીને ચૂકવ્યા અને ત્યારબાદ દર મહિને આગળની ચૂકવણી કરતાં રૂ. 150/- વધુ ચૂકવ્યા. મહેશે કેટલા માસ સુધી હપ્તા ચૂકવ્યા હશે ?

(A) 25 માસ

(B) 21 માસ

(C) 19 માસ

(D) 35 માસ

84. કોઈ પણ ત્રિકોણના અંદરના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલા અંશ થાય ?

(A) 360° અંશ

(B) 180° અંશ

(C) 90° અંશ

(D) 100° અંશ

85. એક હેક્ટર બરાબર કેટલા ચોરસ મીટર થાય ?

(A) 100 ચોરસ મીટર

(B) 1000 ચોરસ મીટર

(C) 10,000 ચોરસ મીટર

(D) 1,00,000 ચોરસ મીટર

86. જમીન પર એક ટાવર શિરોકંબ સ્થિતિમાં છે તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60° છે. તો ટાવરની ઊંચાઈ શોધો.

(A) 175 મીટર

(B) 150 મીટર

(C) 100 મીટર

(D) 173 મીટર



$$\frac{3}{4}$$

87. એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ વય 16 વર્ષ છે. જો તેમાં એક શિક્ષકની વય ઉમેરવામાં આવે તો સરેરાશ વયમાં એક વર્ષનો વધારો થાય છે. તો શિક્ષકની વય કેટલા વર્ષ હશે?

(A) 30 વર્ષ

(B) 31 વર્ષ

(C) 42 વર્ષ

(D) 47 વર્ષ

$$\begin{array}{r} 180 \\ - 527 \\ \hline 47 \end{array} \quad \begin{array}{r} 310 \\ - 217 \\ \hline 93 \end{array}$$

$$\frac{3}{4}$$

88. એક પુરુષના ફોટોની સામે જોઈને રમેશ બોલ્યો, “આની મા મારા પિતાના દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન.” તો રમેશ કોના ફોટોને જોઈ રહ્યો હશે?

(A) તેના કાકાના

(B) તેના પુત્રના

(C) તેના પિતરાઈના

(D) તેના ભનીજાના


89. ચાર ભિત્રો A, B, C અને D કેરમની રમત રમે છે. A અને B એક બીજાની સામે મોં રાખીને બેઠેલા ભેરુઓ છે. D ઉત્તર દિશા તરફ મોં રાખીને બેઠો છે. A પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેઠો છે. તો દક્ષિણ તરફ મોં રાખીને કોણ બેદું છે?

(A) D

(B) C

(C) B

(D) A



90. એક વેપારી 15% નફો લઈ એક વસ્તુ રૂ. 100/-માં વેચાડા કરે છે. તો તેની પડતર કોસ્ટ (ખરીદ કિંમત) કેટલી હશે?

(A) રૂ. 85.00

$$115 \sqrt{10000}$$

(B) રૂ. 85.15

(C) રૂ. 86.96

(D) રૂ. 115.00

91. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સુત્ર જણાવો.

(A) $2\pi r$, જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા છે.

(B) πd , જ્યાં d વર્તુળનો વ્યાસ છે.

(C) $\sqrt{2\pi r}$, જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા છે.

(D) πr^2 , જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા છે.

92. 8.4 સે.મી. ત્રિજ્યાવાળા વર્તુળનો પરિધ કેટલો થાય?

(A) 52.8 સે.મી.

$$2 \times \frac{22}{7} \times \frac{84}{2} \times 2$$

(B) 53.9 સે.મી.

(D) 84.8 સે.મી.

$$\frac{480}{48}$$

$$\frac{22}{22}$$

$$231 \frac{86}{2000}$$

$$\frac{184}{160}$$

$$\frac{138}{138}$$

93. એક લંબચોરસની લંબાઈ 2 મીટર છે. પહોળાઈ 25 સે.મી. છે. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સે.મીટર થાય ?

- (A) 50 ચો. સે.મી.
 (B) 50 ચો. મીટર
 (C) 5000 ચો. સે.મી.
 (D) 5000 ચો. મીટર

94. એક વેપારી રૂ. 10,000/- દર વર્ષે 10% ચકવૃદ્ધિ વાજે 4 વર્ષ માટે પેઢીમાંથી લોન લે છે. તો 4 વર્ષના અંતે વ્યાજની કેટલી રકમ થાય ?

- 1000
 1150
 1210
 1331
~~14641~~
 15100
 16000
 17000
~~18000~~
 19000
 20000
 21000
 22000
 23000
 24000
 25000
 26000
 27000
 28000
 29000
 30000
 31000
 32000
 33000
 34000
 35000
 36000
 37000
 38000
 39000
 40000
 41000
 42000
 43000
 44000
 45000
 46000
 47000
 48000
 49000
 50000
 51000
 52000
 53000
 54000
 55000
 56000
 57000
 58000
 59000
 60000
 61000
 62000
 63000
 64000
 65000
 66000
 67000
 68000
 69000
 70000
 71000
 72000
 73000
 74000
 75000
 76000
 77000
 78000
 79000
 80000
 81000
 82000
 83000
 84000
 85000
 86000
 87000
 88000
 89000
 90000
 91000
 92000
 93000
 94000
 95000
 96000
 97000
 98000
 99000
 100000
 101000
 102000
 103000
 104000
 105000
 106000
 107000
 108000
 109000
 110000
 111000
 112000
 113000
 114000
 115000
 116000
 117000
 118000
 119000
 120000
 121000
 122000
 123000
 124000
 125000
 126000
 127000
 128000
 129000
 130000
 131000
 132000
 133000
 134000
 135000
 136000
 137000
 138000
 139000
 140000
 141000
 142000
 143000
 144000
 145000
 146000
 147000
 148000
 149000
 150000
 151000
 152000
 153000
 154000
 155000
 156000
 157000
 158000
 159000
 160000
 161000
 162000
 163000
 164000
 165000
 166000
 167000
 168000
 169000
 170000
 171000
 172000
 173000
 174000
 175000
 176000
 177000
 178000
 179000
 180000
 181000
 182000
 183000
 184000
 185000
 186000
 187000
 188000
 189000
 190000
 191000
 192000
 193000
 194000
 195000
 196000
 197000
 198000
 199000
 200000
 201000
 202000
 203000
 204000
 205000
 206000
 207000
 208000
 209000
 210000
 211000
 212000
 213000
 214000
 215000
 216000
 217000
 218000
 219000
 220000
 221000
 222000
 223000
 224000
 225000
 226000
 227000
 228000
 229000
 230000
 231000
 232000
 233000
 234000
 235000
 236000
 237000
 238000
 239000
 240000
 241000
 242000
 243000
 244000
 245000
 246000
 247000
 248000
 249000
 250000
 251000
 252000
 253000
 254000
 255000
 256000
 257000
 258000
 259000
 260000
 261000
 262000
 263000
 264000
 265000
 266000
 267000
 268000
 269000
 270000
 271000
 272000
 273000
 274000
 275000
 276000
 277000
 278000
 279000
 280000
 281000
 282000
 283000
 284000
 285000
 286000
 287000
 288000
 289000
 290000
 291000
 292000
 293000
 294000
 295000
 296000
 297000
 298000
 299000
 300000
 301000
 302000
 303000
 304000
 305000
 306000
 307000
 308000
 309000
 310000
 311000
 312000
 313000
 314000
 315000
 316000
 317000
 318000
 319000
 320000
 321000
 322000
 323000
 324000
 325000
 326000
 327000
 328000
 329000
 330000
 331000
 332000
 333000
 334000
 335000
 336000
 337000
 338000
 339000
 340000
 341000
 342000
 343000
 344000
 345000
 346000
 347000
 348000
 349000
 350000
 351000
 352000
 353000
 354000
 355000
 356000
 357000
 358000
 359000
 360000
 361000
 362000
 363000
 364000
 365000
 366000
 367000
 368000
 369000
 370000
 371000
 372000
 373000
 374000
 375000
 376000
 377000
 378000
 379000
 380000
 381000
 382000
 383000
 384000
 385000
 386000
 387000
 388000
 389000
 390000
 391000
 392000
 393000
 394000
 395000
 396000
 397000
 398000
 399000
 400000
 401000
 402000
 403000
 404000
 405000
 406000
 407000
 408000
 409000
 410000
 411000
 412000
 413000
 414000
 415000
 416000
 417000
 418000
 419000
 420000
 421000
 422000
 423000
 424000
 425000
 426000
 427000
 428000
 429000
 430000
 431000
 432000
 433000
 434000
 435000
 436000
 437000
 438000
 439000
 440000
 441000
 442000
 443000
 444000
 445000
 446000
 447000
 448000
 449000
 450000
 451000
 452000
 453000
 454000
 455000
 456000
 457000
 458000
 459000
 460000
 461000
 462000
 463000
 464000
 465000
 466000
 467000
 468000
 469000
 470000
 471000
 472000
 473000
 474000
 475000
 476000
 477000
 478000
 479000
 480000
 481000
 482000
 483000
 484000
 485000
 486000
 487000
 488000
 489000
 490000
 491000
 492000
 493000
 494000
 495000
 496000
 497000
 498000
 499000
 500000
 501000
 502000
 503000
 504000
 505000
 506000
 507000
 508000
 509000
 510000
 511000
 512000
 513000
 514000
 515000
 516000
 517000
 518000
 519000
 520000
 521000
 522000
 523000
 524000
 525000
 526000
 527000
 528000
 529000
 530000
 531000
 532000
 533000
 534000
 535000
 536000
 537000
 538000
 539000
 540000
 541000
 542000
 543000
 544000
 545000
 546000
 547000
 548000
 549000
 550000
 551000
 552000
 553000
 554000
 555000
 556000
 557000
 558000
 559000
 560000
 561000
 562000
 563000
 564000
 565000
 566000
 567000
 568000
 569000
 570000
 571000
 572000
 573000
 574000
 575000
 576000
 577000
 578000
 579000
 580000
 581000
 582000
 583000
 584000
 585000
 586000
 587000
 588000
 589000
 590000
 591000
 592000
 593000
 594000
 595000
 596000
 597000
 598000
 599000
 600000
 601000
 602000
 603000
 604000
 605000
 606000
 607000
 608000
 609000
 610000
 611000
 612000
 613000
 614000
 615000
 616000
 617000
 618000
 619000
 620000
 621000
 622000
 623000
 624000
 625000
 626000
 627000
 628000
 629000
 630000
 631000
 632000
 633000
 634000
 635000
 636000
 637000
 638000
 639000
 640000
 641000
 642000
 643000
 644000
 645000
 646000
 647000
 648000
 649000
 650000
 651000
 652000
 653000
 654000
 655000
 656000
 657000
 658000
 659000
 660000
 661000
 662000
 663000
 664000
 665000
 666000
 667000
 668000
 669000
 670000
 671000
 672000
 673000
 674000
 675000
 676000
 677000
 678000
 679000
 680000
 681000
 682000
 683000
 684000
 685000
 686000
 687000
 688000
 689000
 690000
 691000
 692000
 693000
 694000
 695000
 696000
 697000
 698000
 699000
 700000
 701000
 702000
 703000
 704000
 705000
 706000
 707000
 708000
 709000
 710000
 711000
 712000
 713000
 714000
 715000
 716000
 717000
 718000
 719000
 720000
 721000
 722000
 723000
 724000
 725000
 726000
 727000
 728000
 729000
 730000
 731000
 732000
 733000
 734000
 735000
 736000
 737000
 738000
 739000
 740000
 741000
 742000
 743000
 744000
 745000
 746000
 747000
 748000
 749000
 750000
 751000
 752000
 753000
 754000
 755000
 756000
 757000
 758000
 759000
 760000
 761000
 762000
 763000
 764000
 765000
 766000
 767000
 768000
 769000
 770000
 771000
 772000
 773000
 774000
 775000
 776000
 777000
 778000
 779000
 780000
 781000
 782000
 783000
 784000
 785000
 786000
 787000
 788000
 789000
 790000
 791000
 792000
 793000
 794000
 795000
 796000
 797000
 798000
 799000
 800000
 801000
 802000
 803000
 804000
 805000
 806000
 807000
 808000
 809000
 810000
 811000
 812000
 813000
 814000
 815000
 816000
 817000
 818000
 819000
 820000
 821000
 822000
 823000
 824000
 825000
 826000
 827000
 828000
 829000
 830000
 831000
 832000
 833000
 834000
 835000
 836000
 837000
 838000
 839000
 840000
 841000
 842000
 843000
 844000
 845000
 846000
 847000
 848000
 849000
 850000
 851000
 852000
 853000
 854000
 855000
 856000
 857000
 858000
 859000
 860000
 861000
 862000
 863000
 864000
 865000
 866000
 867000
 868000
 869000
 870000
 871000
 872000
 873000
 874000
 875000
 876000
 877000
 878000
 879000
 880000
 881000
 882000
 883000
 884000
 885000
 886000
 887000
 888000
 889000
 890000
 891000
 892000
 893000
 894000
 895000
 896000
 897000
 898000
 899000
 900000
 901000
 902000
 903000
 904000
 905000
 906000
 907000
 908000
 909000
 910000
 911000
 912000
 913000
 914000
 915000
 916000
 917000
 918000
 919000
 920000
 921000
 922000
 923000
 924000
 925000
 926000
 927000
 928000
 929000
 930000
 931000
 932000
 933000
 934000
 935000
 936000
 937000
 938000
 939000
 940000
 941000
 942000
 943000
 944000
 945000
 946000
 947000
 948000
 949000
 950000
 951000
 952000
 953000
 954000
 955000
 956000
 957000
 958000
 959000
 960000
 961000
 962000
 963000
 964000
 965000
 966000
 967000
 968000
 969000
 970000
 971000
 972000
 973000
 974000
 975000
 976000
 977000
 978000
 979000
 980000
 981000
 982000
 983000
 984000
 985000
 986000
 987000
 988000
 989000
 990000
 991000
 992000
 993000
 994000
 995000
 996000
 997000
 998000
 999000
 1000000
 1001000
 1002000
 1003000
 1004000
 1005000
 1006000
 1007000
 1008000
 1009000
 1010000
 1011000
 1012000
 1013000
 1014000
 1015000
 1016000
 1017000
 1018000
 1019000
 1020000
 1021000
 1022000
 1023000
 1024000
 1025000
 1026000
 1027000
 1028000
 1029000
 1030000
 1031000
 1032000
 1033000
 1034000
 1035000
 1036000
 1037000
 1038000
 1039000
 1040000
 1041000
 1042000
 1043000
 1044000
 1045000
 1046000
 1047000
 1048000
 1049000
 1050000
 1051000
 1052000
 1053000
 1054000
 1055000
 1056000
 1057000
 1058000
 1059000
 1060000
 1061000
 1062000
 1063000
 1064000
 1065000
 1066000
 1067000
 1068000
 1069000
 1070000
 1071000
 1072000
 1073000
 1074000
 107500